

વેચાણ દસ્તાવેજ

“SAMRUDDHI HAYOSHA”

આજરોજ તારીખ :/...../૨૦૨૧ ના રોજ **“SAMRUDDHI HAYOSHA”**
નામની યોજના પૈકી વીગ / ટાવર : ના માળ ઉપર આવેલ ફ્લેટ / દુકાન /
યુનિટ નંબર : નો રૂા...../ - માં વેચાણ દસ્તાવેજ

લખી આપનાર / જમીન માલિક / પ્રમોટર / પહેલા પક્ષવાળા :

HAYOSHA BUILDTECH [PAN : AANFH 7967 A] નામની ભાગીદારી પેઢી વતી અને તર્ફે
વહીવટકર્તા ભાગીદાર [Aadhar No.]

ઉ.વ.આ.પુખ્ત, ધંધો : વેપાર, પેઢીનું સરનામું : ૧૫-૧૬, શિવમ્ ટ્રેડ સેન્ટર, સોનલ પાર્ક
સોસાયટી, અટલાદરા - કલાલી રોડ, વડોદરા.

(જેમને હવે પછી સદર વેચાણ દસ્તાવેજમાં **“પહેલા પક્ષવાળા”** અથવા **“વેચાણ આપનાર”**
અથવા **“અમો”** તે રીતે સંબોધવામાં આવેલ છે. જે શબ્દના અર્થમાં પહેલા પક્ષવાળી પેઢી ના
હાલના તથા વખતો વખતના હયાત ભાગીદારોનો પોતેજાતે તથા તેઓના વંશ, વાલી, વારસો,
સકસેસરો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમીનીસ્ટ્રેટરો, ઈત્યાદી તમામનો સમાવેશ થાય છે.)

લખી લેનાર / વેચાણ રાખનાર / બીજા પક્ષવાળા :

(1), Aged years, Occupation
[PAN :] – [Aadhaar No.....]

(2), Aged years, Occupation
[PAN :] – [Aadhaar No.....]

Residing at

(જેમને હવે પછી સદર વેચાણ દસ્તાવેજમાં **“બીજા પક્ષવાળા”** અથવા **“વેચાણ રાખનાર”**
અથવા **“તમો”** તે રીતે સંબોધવામાં આવેલ છે. જે શબ્દના અર્થમાં બીજા પક્ષવાળા તથા તેઓના
વંશ, વાલી, વારસો, સકસેસરો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમીનીસ્ટ્રેટરો, ઈત્યાદી તમામનો
સમાવેશ થાય છે.)

સદર વેચાણ દસ્તાવેજ અમો / લખી આપનારા તમો / બીજા પક્ષવાળાને અમારી રાજીખુશીથી
લખી આપીએ છીએ કે

૧. (એ) જત, સદરહું ગુજરાત રાજ્યના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ-ડીસ્ટ્રીક્ટ વડોદરા ના
મોજે કપુરાઈ ની સીમમાં સર્વે / બ્લોક નંબર : ૨૩૪, જેનું ૭/૧૨ મુજબનું ક્ષેત્રફળ :
૬૮૮૦-૦૦ ચો. મીટર વાળી જમીનનો જુનો સર્વે નંબર : ૩૩૭ છે. સદરહું જમીનનો
સમાવેશ મુસદ્દાનુપ નગર રચના યોજના નંબર : ૪૦ માં થતા તેનો અંતિમ ખંડ (એફ. પી.)

નંબર : ૧૪૧ ફાળવવામાં આવેલ છે, અને અંતીમ ખંડ (એફ. પી.) મુજબનું ક્ષેત્રફળ : ૪૧૨૮-૦૦ ચો. મીટર વાળી જમીન લખી આપનાર / જમીન માલિક / પ્રમોટર / પહેલા પક્ષવાળા **HAYOSHA BUILDTECH**, નામની ભાગીદારી પેઢી ના નામે સદરહું જમીન અગાઉના જમીન માલિકો — દમયંતીબેન વિનોદભાઈ પટેલ, ભરતભાઈ વિનોદભાઈ પટેલ, કિરણબેન વિનોદભાઈ પટેલ તે કમલેશકુમાર પટેલના પત્નિ, નયનભાઈ વિનોદભાઈ પટેલ નાઓ પાસેથી વેચાણ રાખી તારીખ : ૧૦/૦૫/૨૦૨૧ ના રોજ વેચાણ દસ્તાવેજ અનુક્રમ નંબર : ૬૨૮૭ થી વેચાણ દસ્તાવેજ સબ-રજીસ્ટ્રાર કચેરી, વડોદરા (વિભાગ-૫) માં નોંધાવી માલિક બનેલ છે, જે વેચાણ દસ્તાવેજ ના અમો / લખી આપનારાઓના નામની નોંધ ગામના રેવન્યુ રેકર્ડ (૬, ૭/૧૨) માં ફેરફાર નોંધ નંબર :, તારીખ :/૦૫/૨૦૨૧ થી થયેલ છે.

જત, વડોદરાના મોજે ગામ : કપુરાઈ ની સીમમાં સર્વે / બ્લોક નંબર : ૨૩૪, જુનો સર્વે નંબર : ૩૩૭, જેનું ૭/૧૨ મુજબનું ક્ષેત્રફળ : ૬૮૮૦-૦૦ ચો. મીટર પૈકી ૪૭૮૬-૦૦ ચો. મીટર વાળી જમીન નો બીન- ખેતી હેતુ (બહુહેતુક ઉપયોગ) માટે ઉપયોગ કરવાની પરવાનગી મહેરબાન કલેક્ટરશ્રી, વડોદરાના હુકમ ક્રમાંક નંબર : ૫૯૮ / ૧૯ / ૧૭ / ૦૪૫ / ૨૦૧૯, તારીખ : ૧૩/૦૮/૨૦૧૯ ના રોજ બીન-ખેતી શાખા, કલેક્ટર કચેરી વડોદરામાંથી મેળવવામાં આવેલ છે. આ હુકમની નોંધ ગામના રેવન્યુ રેકર્ડ (૬, ૭/૧૨) માં ફેરફાર નોંધ નંબર : ૫૧૪૧, તારીખ : ૧૩/૦૮/૨૦૧૯ (પ્રમાણિત તારીખ : ૨૦/૦૯/૨૦૧૯) થી કરવામાં આવેલ છે.

(બી) ગુજરાત રાજ્યના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ-ડીસ્ટ્રીક્ટ વડોદરા ના મોજે કપુરાઈ ની સીમમાં સર્વે / બ્લોક નંબર : ૨૩૬, જેનું ૭/૧૨ મુજબનું ક્ષેત્રફળ : ૩૯૪૬-૦૦ ચો. મીટર વાળી જમીનનો જુનો સર્વે નંબર : ૩૩૬ છે. સદરહું જમીનનો સમાવેશ મુસદ્દા રૂપ નગર રચના યોજના નંબર : ૪૦ માં થતા તેનો અંતિમ ખંડ (એફ. પી.) નંબર : ૧૪૨ ફાળવવામાં આવેલ છે, અને અંતીમ ખંડ (એફ. પી.) મુજબનું ક્ષેત્રફળ : ૨૩૬૮-૦૦ ચો. મીટર વાળી જમીન લખી આપનાર / જમીન માલિક / પ્રમોટર / પહેલા પક્ષવાળા **HAYOSHA BUILDTECH**, નામની ભાગીદારી પેઢી ના નામે સદરહું જમીન અગાઉના જમીન માલિકો — જગદિશભાઈ યુનીલાલ પટેલ, ચંદ્રકાંત યુનીલાલ પટેલ, આત્મીય બાલકૃષ્ણ પટેલ, મોનીકાબેન ભુપેન્દ્રભાઈ પટેલ, આત્મીય ભુપેન્દ્રભાઈ પટેલ, ઈસીતાબેન ભુપેન્દ્રભાઈ પટેલ નાઓ પાસેથી વેચાણ રાખી તારીખ : ૧૦/૦૫/૨૦૨૧ ના રોજ વેચાણ દસ્તાવેજ અનુક્રમ નંબર : ૬૨૮૬ થી વેચાણ દસ્તાવેજ સબ-રજીસ્ટ્રાર કચેરી, વડોદરા (વિભાગ-૫) માં નોંધાવી માલિક બનેલ છે, જે વેચાણ દસ્તાવેજ ના અમો / લખી આપનારાઓના નામની નોંધ ગામના રેવન્યુ રેકર્ડ (૬, ૭/૧૨) માં ફેરફાર નોંધ નંબર :, તારીખ :/૦૫/૨૦૨૧ થી થયેલ છે.

જત, વડોદરાના મોજે ગામ : કપુરાઈ ની સીમમાં સર્વે / બ્લોક નંબર : ૨૩૬, જેનું ૭/૧૨ મુજબનું ક્ષેત્રફળ : ૩૯૪૬-૦૦ ચો. મીટર પૈકી ૨૩૬૮-૦૦ ચો. મીટર વાળી જમીન નો બીન- ખેતી હેતુ (બહુહેતુક ઉપયોગ) માટે ઉપયોગ કરવાની પરવાનગી મહેરબાન કલેક્ટરશ્રી, વડોદરાના હુકમ ક્રમાંક નંબર : ૯૫૯ / ૧૯ / ૧૭ / ૦૪૫ / ૨૦૧૯, તારીખ :

: ૧૮/૦૯/૨૦૧૯ ના રોજ બીન-ખેતી શાખા, કલેક્ટર કચેરી વડોદરામાંથી મેળવવામાં આવેલ છે. આ હુકમની નોંધ ગામના રેવન્યુ રેકર્ડ (૬, ૭/૧૨) માં ફેરફાર નોંધ નંબર : ૫૧૬૭, તારીખ : ૧૮/૦૯/૨૦૧૯ (પ્રમાણિત તારીખ : ૨૭/૧૧/૨૦૧૯) થી કરવામાં આવેલ છે.

(સી) જત, ઉપર જણાવેલ વડોદરા ના મોજે ગામ : કપૂરાઈ ની સીમમાં રેવન્યુ સર્વે નંબર : ૨૩૪, ૨૩૬, ટી. પી. સ્કીમ નંબર : ૪૧, ફાઈનલ પ્લોટ નંબર : ૧૪૧ (૪૧૨૮-૦૦ ચો. મીટર), અને ૧૪૨ (૨૩૬૮-૦૦ ચો. મીટર) વાળી કુલ ક્ષેત્રફળ : ૬૪૯૬-૦૦ ચો. મીટર વાળી જમીનમાં બાંધકામ કરવાની પરવાનગી વડોદરા મહાનગર પાલીકાની રજાચીઠી નંબર : RAH (રહે. + વાણી) વોર્ડ - ૩ / એસ.એચ.બી. - ૧૨/ ૨૦૨૧ - ૨૦૨૨, તારીખ : ૨૭/૦૪/૨૦૨૧ થી મેળવ્યા મુજબ અને મંજૂર થયેલ નકશા મુજબ **“SAMRUDDHI HAYOSHA”** નામની યોજનાનું આયોજન કરવામાં આવેલ છે.

(ડી) જત, જમીન માલિક / પ્રમોટર / પહેલા પક્ષવાળા / વિકાસકર્તા / ડેવલોપર તરફથી સદરહું યોજનાનું રજીસ્ટ્રેશન રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા) માં નોંધની નંબર / **RERA Certificate No.** થી કરાવેલ છે અને સદરહું કાયદાના મોડલ એગ્રીમેન્ટ (કરાર) મુજબ જમીન માલિક અને ડેવલોપર તરફથી સદરહું વેચાણ દસ્તાવેજમાં જણાવેલ વેચાણ લેનાર / ખરીદનારનાની તર્ફે નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલકતનું બાનાખત કરાર સબ - રજીસ્ટ્રાર કચેરી, વડોદરામાં અનુક્રમ નંબર :, તારીખ :/...../..... અથવા નોટરી પબ્લીકના નોટરી રજીસ્ટર નંબર :, તારીખ :/...../..... થી નોંધાવવામાં આવેલ છે. આમ, ઉપરોક્ત જણાવેલ તમામ પક્ષવાળાઓને રેરાના કાયદાની તમામ કલમો/નિયમોથી સંમત અને બંધનકર્તા છે અને આમ સદરહું વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ છે. અને તમો / લખી લેનારાએ યોજનાને લગતા તમામ ડોક્યુમેન્ટ જેવાકે જમીન માલિકના માલિક હક્ક તથા કબજા હક્કના પુરાવા, મંજૂર થયેલ નકશા, સ્થળ ઉપર થઈ રહેલ/થનાર બાંધકામના વર્કિંગ ડ્રોઈંગ, ટાઈટલ કલીયર સર્ટીફિકેટ, વિકાસ પરવાનગી વિગેરે અન્ય જોઈ તપાસી ખાતરી કરી સદરહું યોજનામાં આવેલ પીરશિષ્ટમાં દર્શાવેલ મિલકત વેચાણ રાખેલ છે.

૨. જત, સદર તમો / લખી લેનારને નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલકત અમો / પહેલા પક્ષવાળા / લખી આપનારની રાજખુશીથી આપણી વચ્ચે અગાઉ નક્કી થયેલ યોગ્ય અને વ્યાજબી બજારકિંમત રૂા...../- અંકે રૂપીયા પુરા માં વેચાણ આપવાનું નક્કી કરેલ હોઈ, નક્કી થયા મુજબનો વેચાણ અવેજ ચુકતે મળતાં સદર વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ છે. સદર કુલ વેચાણ અવેજની રકમ તમો લખી લેનારા તરફથી અમોને નીચેની વિગત મુજબ ચુકતે વસુલ પ્રાપ્ત થયેલ છે.

વેચાણ અવેજ મળ્યાની વિગત:-

રકમ (રૂ.)	તારીખ	ચેક / ડીડી નંબર	બેંક / અન્ય વિગત

સદર ઉપરોક્ત વિગત મુજબ વેચાણ અવેજની રકમ તમો આ લેખના લખી લેનારા તરફથી આ વેચાણ દસ્તાવેજ અન્વયે ચુકતે મળ્યાની આથી પહોંચ પાવતી આપી તે વેચાણ અવેજ ચુકતે મળ્યાનું કબુલ કરી અને તેના બદલામાં આ વેચાણ દસ્તાવેજ લખી આપેલ છે. અને વધુમાં સરકારશ્રીના કાયદાઓ હેઠળ નાયબ નોંધણી નિરીક્ષકશ્રી, ગાંધીનગરનાએ કરેલ પરિપત્રમાં જણાવ્યા મુજબ ભારતીય નોંધણી અધિનીયમ -૧૯૦૮ ની કલમ - ૨૧ અન્વયે નોંધણી અર્થે રજુ થતાં લેખોમાં મિલકતની સ્પષ્ટ ઓળખ માટે મિલકતનો ફોટો લગાવવો જરૂરી હોઈ, આ લેખ અન્વયે હાલ સ્થળસ્થિતી મુજબની મિલકતનો ફોટો લગાવી આપણી વચ્ચે નક્કી થયા મુજબ આ વેચાણ દસ્તાવેજ લખી આપી, અમો લખી આપનાર-પેઢી નાએ નક્કી થયા મુજબની મિલકત વેચાણ આપી, તમો / લખી લેનારાને ખાલી, શાંત અને પ્રત્યક્ષ કબજો માલીકી હક્કે સોંપેલ છે. જેનો ખાલી, શાંત અને પ્રત્યક્ષ કબજો ભોગવટો સંપૂર્ણ માલીકી હક્કેથી તમો લખી લેનારાએ સંભાળી લીધેલ છે. અને સદરહું યોજનાનું કંમ્પલીશન સર્ટીફિકેટ આવ્યા તારીખથી અથવા પઝેશન આવ્યા તારીખથી પાંચ - વર્ષ સુધી વેચાણ આપેલ મિલકતને લગતી કોઈ ખામીઓ ઉપસ્થિત થાય તો તેનું રીપેરીંગ / મરમ્મત / સમારકામ કરી આપવાની તમામ જવાબદારી લખી આપનાર ની છે અને રહેશે, અને જો તે ખામીઓ નું રીપેરીંગ / મરમ્મત / સમારકામ તમો લખાવી લેનારે કરવાનું થાય તો તે અંગે લખાવી લેનારે કરેલ તમામ ખર્ચ લખી આપનાર આપવા બંધાયેલ છે. પરંતુ લખી આપનારના કાબુ બહારના સંજોગો અથવા અન્ય કોઈ ચોક્કસ કારણો કે જે લખી આપનારને લગતુ ના હોય તો તેવા સંજોગોમાં થયેલ નુકશાનની જવાબદારી લખી આપનારની રહેશે નહીં. તેમજ તે સીવાયની એટલેકે જોઈ તપાસી ચોક્કસાઈ પૂર્વક ખાતરી કરી કબજો સંભાળી લીધા બાદ જો વેચાણ રાખેલ મિલકતમાં અન્ય કોઈ ખામી વેચાણ રાખનાર ધ્વારા ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અને તેને લગતો તમામ ખર્ચની પણ જવાબદારી તમો વેચાણ રાખનારની છે અને રહેશે તેવી સ્પષ્ટ સમજુતી સહ સદરહું વેચાણ દસ્તાવેજ કરેલ છે.

- સદર જમીન મિલકત ઉપર કોઈ પણ વ્યક્તિ, બેંક, શ્રોફ યા નાણાંકિય સંસ્થાનો ચાર્જ, ગીરો, બોજો કે લીયન કે સુખાધીકાર અગરતો કોઈ પણ પ્રકારનો કોઈ પણ હક્ક કે અધિકાર અમો / લખી આપનારે ઉભો કરેલ નથી. તેમજ સદર જમીન મિલકત અમોએ અન્ય કોઈને જામીનગીરીમાં લખી આપેલ નથી કે તેના ઉપર કોર્ટનો મનાઈ હુકમ કે એટેચમેન્ટ નથી. સદર જમીન મિલકત અંગે અમોએ કોઈ પણ પ્રકારના વેચાણ કે ટ્રાન્સફર કરવા અંગેનો કરાર, બાનાખતથી કે ભેટ કરારથી કે લેખીત યા મૌખીક અન્ય કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે

વ્યક્તિના સમુહની તરફેણમાં કરી આપેલ નથી. અમો / લખી આપનારે તમોને વેચાણ આપેલ મિલકતના ટાઈટલ કિલયર અને માર્કેટબલ છે તેવો પાકો ભરોસો અને વિશ્વાસ આપીએ છીએ. તેમ છતાં સદર જમીન મિલકતના ટાઈટલ અંગે કોઈ પણ જાતનો વાંધો અગર તકરાર યા અડચણ ઉભી થાય તો તે તમામ હરકતો અમો / લખી આપનાર, તમોને અમારા ખર્ચે દુર કરાવી આપીશું. જો તે તમારે દુર કરવા યા કરાવવાનો પ્રસંગ આવેતો તે અંગેનો તમામ ખર્ચ અમો / લખી આપનાર તમોને તાત્કાલીક કોઈપણ પ્રકારની તકરાર સીવાય ચુકવી આપવા માટે બંધાયેલા છીએ તેની બાંહેધરી અને વિશ્વાસ આપવામાં આવે છે.

૪. સદર જમીન મિલકત અંગેના આજદિન સુધીના તમામ સરકારી તેમજ અર્ધ-સરકારી વેરા, વડોદરા મહાનગર સેવાસદનના ટેક્ષા તથા રેવન્યુ ટેક્ષા અમોએ ભરેલા છે અને સદર વેચાણ દસ્તાવેજ થયા બાદના તમામ વેરા તથા ટેક્ષા તમો / વેચાણ લેનારે ભરવાના રહેશે. પરંતુ સદર વેચાણ દસ્તાવેજ થયા બાદ ભવિષ્યમાં આજદિન સુધીના જો કોઈ વેરા અથવા ટેક્ષા બાકી નીકળી આવશે તો તે તમામ રકમ અમો / લખી આપનારે ભરવાની રહેશે તેવી બાંહેધરી અને વિશ્વાસ આપવામાં આવે છે. તથા સર્વીસેટ્ટેક્ષા, વેટ તથા સરકારી અર્ધસરકારી તથા કોર્પોરેશનમાં જેકાંઈ વેરા આવે તે તમામ વેરાઓ વેચાણ દસ્તાવેજ થયાબાદ લખી લેનારે ભરવાના રહેશે. સદર વેચાણ દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી ફી, લખાઈ ફી વિગેરે જેવો તમામ ખર્ચ તમો / લખી લેનારે ભોગવેલ છે અને ભવિષ્યની જે કાંઈ વધારાની સ્ટેમ્પ ડ્યુટીની રકમ ભરવાની આવે તો તે તમામ રકમ ભરવાની જવાબદારી તમો / વેચાણ લેનારની છે.

૫. સદર નીચે પરિશિષ્ટમાં જણાવેલ વેચાણ આપેલ મિલકત તમો / વેચાણ રાખનારને નળ, ડ્રેનેજ, લાઈટ, કોમન ટોઈલેટ, કોમન લીફ્ટ વિગેરે તમામ સુવીધાઓને લાગતા તમામ પ્રકારના હક્કો સહ, હવા ઉજાસ તથા સુખાધીકારના હક્કો સાથેની તથા તેને લાગતા વળગતા સોસાયટીના આંતરીક તથા સહીયારા રસ્તાના તથા પાણી નિકાલના સર્વે પ્રકારના હક્કો સાથેની મિલકતના તમામ પ્રકારના કોમન હક્કો સાથેની તથા **“SAMRUDDHI HAYOSHA”**ના સભાસદ તરીકેના તમામ હક્કો યાવત ચંદ્ર દિવાકરો, કુલ અભરામના દાવે સુરજ ચંદ્ર તપે ત્યા સુધીના હક્કો તથા અધિકાર સાથે આજરોજ વેચાણ આપવામાં આવે છે. સદર પરિશિષ્ટમાં જણાવેલ મિલકતના તમો / બીજા પક્ષવાળા આજથી માલિક થયા છો અને આ મિલકતનો માલિકી હક્ક કોમ્પલેક્ષના નિયમોને આધિન રહીને તમારે ઉપયોગ અને ઉપભોગ કરવા તથા કરાવવાનો છે. સદર પરિશિષ્ટમાં જણાવેલ મિલકત ઉપર તમો આજથી સંપૂર્ણ હક્ક ધરાવો છો અને તેમાં અમો તથા અમારા વંશ, વાલી, વારસદારોનો કોઈ પણ જાતનો લાગ, ભાગ, હક્ક, હિસ્સાનો સંબંધ રહેતો નથી.

૬. સદર **“SAMRUDDHI HAYOSHA”** નામની યોજના પૈકી નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલકત સદર વેચાણ દસ્તાવેજથી તમોને વેચાણ આપેલ છે. તેથી કોમ્પલેક્ષના બેઝમેન્ટ ફ્લોરમાં આવેલ કોમન પાર્કિંગની જગ્યા તમામ સભાસદો / મેમ્બરોએ કોઈને આપવા-જવામાં અડચણ રૂપ ન થાય તે રીતે પાર્કિંગ કરવું - કરાવવાનું છે. દુકાનને લગતું તમામ પાર્કિંગ દુકાનની આગળના ભાગમાં કોઈને અડચણ રૂપ ન થાય તે રીતે કરવાનું રહેશે. કોઈ પણ સભાસદ અમુક ચોક્કસ જગ્યામાં પાર્કિંગ કરવા-કરાવવા હક્ક અને અધિકાર કરી શકશે

નહી. તમામ સભાસદોએ અનુકુળતા મુજબ પાર્કિંગ માટે મળેલ જગ્યામાંજ પાર્કિંગ કરવું-કરાવવાનું છે અને તમામ સભાસદોએ / મેમ્બરોએ પાર્કિંગની જગ્યામાં કોઈ પણ જાતનું પાર્કિંગ અર્થે અથવા અન્ય કોઈ પણ અર્થે બાંધકામ કરવું-કરાવવાનું નથી.

૭. અમો / લખી આપનારે, તમો / લખી લેનારને વેચાણ આપેલ મિલકતના તમો સ્વતંત્ર માલિક છો અને સદર વેચાણ દસ્તાવેજના આધારે સદરહું મિલકત સીટી સર્વે કચેરી, તલાટી કચેરી, વડોદરા મહાનગર સેવાસદન કચેરી, મધ્ય ગુજરાત વિજ કંપની લિ., રેવન્યુ દફતરે તથા સરકારી તેમજ અર્ધ-સરકારી તથા અન્ય સંસ્થા વિગેરેમાં તમો / વેચાણ રાખનારના નામે કરાવી શકશો. આ માટે અમો / લખી આપનારની જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સહી-સંમતીની જરૂર પડે ત્યાં અને ત્યારે તે તમામ તમો / લખી લેનારને કરી આપવા માટે કાયદેસર બંધાયેલા છીએ. સદર કોમ્પલેક્ષમાં રોડ બાજુ દુકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે. કોમ્પલેક્ષની આગળના ભાગે આવેલ દુકાનો છે તે દુકાનો વેચાણ રાખનારને ફક્ત દુકાન જ વેચાણ આપેલ છે. દુકાનની આગળની ખુલ્લી જગ્યા ફક્ત કોમન પાર્કિંગ માટે રાખેલ છે જે વેચાણ આપેલ નથી અને તે ખુલ્લી જગ્યામાં દુકાન વેચાણ રાખનારે કોઈપણ જાતનો કોઈ કામ ચલાઉ કે કાયમી પ્રકારનું બાંધકામ કરવાનું નથી કે શેડ બનાવવાનો નથી કે કોઈપણ જાતનું દબાણ કરવાનું નથી કે આજુબાજુની મિલકતના માલિકોને અગરતો કોમ્પલેક્ષના અન્ય મિલકત માલિકોને માનસીક ત્રાસ કે દુઃખ, દર્દ કે અડચણ થાય તેવો ઘોંઘાટ કરવાનો નથી. તેમ છતાં આવું કૃત્યા દુકાન વેચાણ રાખનાર કરશે તો તે અટકાવવાની પુરે પુરી સત્તા કોમ્પલેક્ષના અન્ય સભાસદો / માલિકોની છે અને રહેશે અને તેવો તેવી કામગીરીને રોકવા હક્કદાર અને અધિકારી છે અને રહેશે. સદરહું યોજનાની અંદરની બાજુએ આવેલ પાર્કિંગની જગ્યાનો તથા યોજનાની સામુદાયિક એમીનીટીસનો ઉપયોગ સદરહું યોજનાની દુકાન માલિકો / મેમ્બરોએ કરવાનો રહેશે નહીં

૮. સદર વેચાણ આપેલ મિલકત “**SAMRUDDHI HAYOSHA**” માં આવેલ છે. તેથી કોમ્પલેક્ષના તમામ સભાસદો / મેમ્બરો ભેગા મળીને જાળવણી, સાચવણી, સફાઈ, નીભાવણી, કોમન મેન્ટેનન્સ, ચાર્જીસ માટે વિકાસ મંડળ કે એશોસીએશનની રચના કરવામાં આવે તો તેમાં તમો / લખી લેનારે ફરજિયાત સભાસદ / મેમ્બર થવાનું રહેશે અને તેના નીતી નીયમોનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે. તેથી સદર કોમ્પલેક્ષના તમામ સભાસદોએ જે કાંઈ સહીયારા હક્ક અને અધિકાર મળવા પાત્ર છે તે તમામ તમો મેળવાને હક્કદાર છો અને વહિવટ ખર્ચ, કોમન સુવીધા માટે વરાડે/સરખા ભાગે આવતો ખર્ચ પણ તમારે આપવાનો રહેશે. કોમન પેસેજ તથા લીફ્ટમાં અન્ય કોઈને પણ કોઈને અડચણ રૂપ થાય તોવે માલ-સામાન મુકવાનો નથી તથા તમામ સભાસદોને સહકાર આપવાનો રહેશે તેવી સ્પષ્ટ સમજૂતી અને શરતથી સદર વેચાણ દસ્તાવેજ તમોને લખી આપવામાં આવેલ છે.

૯. કોમન લાઈટ, કોમન લીફ્ટ વિગેરે જે કાંઈ મુકવામાં આવે તેનો નીભાવણી ખર્ચ, લાઈટ બીલ તથા સામુદાયિક વપરાશની તમામ ચીજ વસ્તુઓના રીપેરીંગ ખર્ચ, મેન્ટેનન્સ, ચાર્જીસ વિગેરે જેવા તમામ ખર્ચ તથા નવીન નાખવાનો ખર્ચ કોમ્પલેક્ષના તમામ સભાસદોએ વરાડે / સરખા હિસ્સે આપવાનો છે તે પ્રમાણે તમોએ પણ આપવાનો રહેશે.

૧૦. સદર કોમ્પલેક્ષના કલર, એલીવેશન વિગેરેમાં કોઈ પણ મેમ્બર / સભાસદોએ કોઈપણ જાતનો ફેરફાર કરવાનો નથી. સદર કોમ્પલેક્ષ ના સ્ટ્રક્ચરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જેવોકે બીબ કે કોલમમાં સુધારો – વધારો કોઈ પણ સંજોગોમાં હાલમાં કે ભવિષ્યમાં કરી શકશે નહીં પરંતુ આંતરીક દિવાલો, બીબ કે કોલમના બાંધકામમાં કોઈ વધારો કે ઘટાડો કરાવવાનો હોય કે કોઈ ભારે મશીનરી વિગેરે મુકવાની હોય તો તે ગવર્નમેન્ટ સર્ટીફાઈટ સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટની સલાહ અને પરવાનગી લીધા બાદ તથા મિલકતના સહમાલીકોના એસોસીએશન પાસેથી એન.ઓ.સી. મેળવ્યા બાદ જ કરી શકશે. તેમજ સદર સમગ્ર “**SAMRUDDHI HAYOSHA**” નામની યોજનાના વડોદરા મહાનગર સેવા સદને / મ્યુનિસિપલ કોર્પોરેશને બાંધકામ અર્થે મંજૂર કરેલ નકશામાં દર્શાવ્યા મુજબ ખુલ્લી જમીનમાં કોઈ પણ પ્રકારે કોઈ પણ સભાસદ / મેમ્બર હાલમાં કે ભવિષ્યમાં અંગત માલિકી માગી શકશે નહીં. તે જમીન કાયમને માટે ખુલ્લી રાખવા વેચાણ રાખનાર તથા સમગ્ર યોજનાના અન્ય સભાસદો બંધાયેલા છે અને રહેશે. કોમ્પલેક્ષના કોમન દાદાર, કોમન પેસેજમાં કોઈપણ જાતનું કોઈ સામાન મુકવાનો નથી.
૧૧. નીચે પરિશિષ્ટમાં જણાવેલ વેચાણ આપેલ મિલકતની જે દિવાલો બાજુની મિલકત સાથે લાગીને આવેલ છે તે તથા ઉપર – નીચે ના સ્તેબની તમામ દિવાલો તે બંનેની સહીયારી ગણાશે અને તેનું માપ દિવાલના મધ્ય બિંદુથી ગણાવાનું છે.
૧૨. સમગ્ર “**SAMRUDDHI HAYOSHA**” ની તમામ સામુહીક સુવિધાઓ (એમીનીટીશ) માં તમો / વેચાણ રાખનાર કોઈ પણ પ્રકારે માલિકી હક્ક કરી શકશે નહીં કે જુદો ભાગ માંગી શકશે નહીં.
૧૩. ભવિષ્યમાં તમો / વેચાણ રાખનાર નીચે પરિશિષ્ટમાં જણાવેલ મિલકત વેચાણ અથવા તબદિલ અથવા ગીરો કરો ત્યારે સદર વેચાણ દસ્તાવેજથી તમોને જે જે હક્કો અને અધિકારો મળેલ છે, ફક્ત તેજ મળેલ હક્કો અને અધિકારો તથા સદર વેચાણ દસ્તાવેજમાં જણાવેલ ઉપરના નીચમો તથા શરતોને તથા વખતો વખત બનાવવામાં આવેલ નીચમોને આધિન હક્કો અને અધિકારો સહ વેચાણ અથવા તબદિલ અથવા ગીરો કરી શકશો તેવી સ્પષ્ટ શરત સહ સદર વેચાણ દસ્તાવેજ લખી આપેલ છે.
૧૪. સદર યોજનામાં સભાસદોએ જે તે ટાવર માટે આપેલ મેન્ટેનન્સ ચાર્જની રકમના વ્યાજ માંથી જરૂરી ખર્ચાઓ પહોંચી ન શકાય તો જે તે કોમ્પલેક્ષ ના તમામ સભાસદો પાસેથી વધારાના મેન્ટેનન્સ ચાર્જની રકમ ઉઘરાવવાની રહેશે અને તે વધારાના ખર્ચની નક્કી કરેલ રકમ દરેક સભાસદે સરખા હીસ્સે ફરજિયાત આપવાની રહેશે.
૧૫. વિવાદનું નિરાકરણ : કોઈ પણ વિવાદનો નિકાલ સમાધાનથી લાવવાનો રહેશે. જો સમાધાનથી ઉકેલ ન આવે તેમ હોય તો, રીઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ ના નિયમો અને શરતોની જોગવાઈઓને આધીન નિમવામાં આવેલ લવાદ દ્વારા નિકાલ કરવામાં આવશે.

૧૬. એલોટી / લખી લેનાર / અનુગામી એલોટી/લખી લેનાર માટે સદર કરારની જોગવાઈઓ:

સદર કરારની કોઈ પણ જોગવાઈઓ કોઈ પણ કાયદો કે નિયમનો ભંગ થતો હોય તે અન્ય કાયદા હેઠળ તે બિનઅમલકારક હોય અથવા તેનાથી તે જોગવાઈને રદબાતલ કરવામાં આવશે અથવા તેમાં અમલમાં હોય તે કાયદા અનુસાર સુધારા-વધારા કરવામાં આવશે. તે સિવાયની કરારની અન્ય જોગવાઈઓ કરારની મુદત દરમિયાન યથાવત અને અમલપાત્ર રહેશે.

૧૭. એલોટી / અનુગામી એલોટી માટે સદર કરારની જોગવાઈઓ :

સદર કરારની કોઈ પણ જોગવાઈઓ કોઈ પણ કાયદો કે નિયમનો ભંગ થતો હોય તે અન્ય કાયદા હેઠળ તે બિનઅમલકારક હોય અથવા તેનાથી તે જોગવાઈને રદબાતલ કરવામાં આવશે અથવા તેમાં અમલમાં હોય તે કાયદા અનુસાર સુધારા-વધારા કરવામાં આવશે. તે સિવાયની કરારની અન્ય જોગવાઈઓ કરારની મુદત દરમિયાન યથાવત અને અમલપાત્ર રહેશે.

૧૮. જત, સદરહું જમીન માલિક / પ્રમોટર / ડેવલોપર તરફથી જાહેર કરવામાં આવેલ છે કે સદરહું યોજનાનું કમ્પ્લીશન / બી. યુ. સર્ટીફિકેટ આવી ગયા બાદ તેઓ તરફથી સદરહું યોજનાની સંપૂર્ણ જમીન અંગે વધુ એફ.એસ. આઈ. ની માંગણી કરે - કરાવશે નહીં તથા સદરહું યોજનાની અગાથી ઉપર કોઈ હક્ક-અધિકાર રહેશે નહીં મતલબ કે તેઓની સદરહું યોજનાની સંપૂર્ણ જમીન તથા અગાથી ઉપર કોઈ લાગ - ભાગ - હકક - અધિકાર રહેશે નહીં.

પરિશિષ્ટ

વેચાણ આપેલ મિલકતનું વર્ણન

ગુજરાત રાજ્ય ના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, રજીસ્ટ્રેશન સબ-ડીસ્ટ્રીક્ટ વડોદરા ના મોજે ગામ કપૂરાઈ ની સીમમાં રેવન્યુ સર્વે નંબર : ૨૩૪, ૨૩૬, ટી. પી. સ્કીમ નંબર : ૪૧, ફાઈનલ પ્લોટ નંબર : ૧૪૧ (૪૧૨૮-૦૦ ચો. મીટર), અને ૧૪૨ (૨૩૬૮-૦૦ ચો. મીટર) વાળી કુલ ક્ષેત્રફળ : ૬૪૯૬-૦૦ ચો. મીટર જમીનમાં વાળી જમીનમાં બાંધકામ અર્થે મંજૂરી મુજબ આયોજીત “SAMRUDDHI HAYOSHA” નામની યોજનાનું આયોજન કરેલ છે. તે પૈકી નીચે દર્શાવેલ મિલકત સદર વેચાણ દસ્તાવેજ થી વેચાણ આપેલ છે.

વીગ / ટાવર	માળ / ફ્લોર	ફ્લેટ / દુકાન / યુનિટ	કારપેટ એરીયા (ચો.મી.)	એક્સક્લુઝીવ બાલ્કની એરીયા (ચો.મી.)	એક્સક્લુઝીવ વોશ એરીયા (ચો.મી.)	એક્સક્લુઝીવ ખુલ્લી અગાથી (ચો.મી.)	વરાડે પડતી વણવહેંચાયેલ જમીનનું ક્ષેત્રફળ (ચો. મી.)
------------	-------------	-----------------------	-----------------------	------------------------------------	--------------------------------	-----------------------------------	--

		નંબર					

જેની યતુ : સીમા નીચે મુજબ છે.

પૂર્વે :

પશ્ચિમે :

ઉત્તરે :

દક્ષિણે :

સદર વેચાણ દસ્તાવેજ અમો / લખી આપનારાઓએ અમારી રાજખુશીથી વાંચી, વંચાવી, સમજી, વિચારી, વાકેફ થઈ, અકકલ હોંશીયારીથી, બીનકેફ અવસ્થામાં લખી આપેલ છે. જે અમોને તથા અમારા વંશ, વાલી, વારસોને કબુલ મંજુર અને બંધનકર્તા છે અને રહેશેજેના સાક્ષી પુરાવારૂપે નીચે અમારી પોતાની સહીઓ કરી આપેલ છે.

સ્થળ : વડોદરા

તારીખ :/...../૨૦૨૧

લખી આપનાર / જમીન માલિક / પ્રમોટર / પહેલા પક્ષવાળા :

HAYOSHA BUILDTECH, નામની ભાગીદારી પેઢી

વતી વહીવટકર્તા ભાગીદાર

સાક્ષી :


.....


.....

"SAMRUDDHI HAYOSHA", Kapurai, Vadodara

રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ ની કલમ ૩૨ (અ) મુજબ શિડ્યુલ


લખી લેનાર / વેચાણ રાખનાર / બીજી તરફવાળા :





લખી આપનાર / જમીન માલિક / પ્રમોટર / પહેલા પક્ષવાળા :

HAYOSHA BUILDTech, નામની ભાગીદારી પેઢી
વતી વહીવટકર્તા ભાગીદાર



દસ્તાવેજ નંબર : તારીખ : / / ૨૦૨૧

:: પરિશિષ્ટ ::

નોંધણી અધિનિયમ-૧૯૦૮ ની કલમ – ૩૪ ની પેટા કલમ – ૩ મુજબનું ચેકલીસ્ટ

અ.નં.	પ્રશ્ન	જવાબ (હા/ના)
લખી આપનાર / સંમતિ આપનાર કે તેઓના કુ.મુ. ને પુછવાના પ્રશ્નો :		
૧	લેખમાં દર્શાવ્યા મુજબ વડોદરા ના મોજે ગામ કપૂરાઈ ની સીમમાં રેવન્યુ સર્વે નંબર : ૨૩૪, ૨૩૬, ટી. પી. સ્કીમ નંબર : ૪૧, ફાઈનલ પ્લોટ નંબર : ૧૪૧ (૪૧૨૮-૦૦ ચો. મીટર), અને ૧૪૨ (૨૩૬૮-૦૦ ચો. મીટર) વાળી કુલ ફોર્ટફિક્શન : ૬૪૯૬-૦૦ ચો. મીટર જમીનમાં વાળી જમીનમાં બાંધકામ અર્થે મંજૂરી મુજબ આયોજીત “ SAMRUDDHI HAYOSHA ” નામની યોજનામાં વીગ / ટાવર : ના માળ ઉપર આવેલ ફ્લેટ / દુકાન / યુનિટ નંબર : નો વેચાણ દસ્તાવેજ લેખ કરી આપેલ છે?	હા
૨	લેખમાં દર્શાવ્યા મુજબ ચો.મી. કારપેટ નું ફોર્ટફિક્શન છે તે મિલકત માટે લેખ / વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ છે?	હા
૩	લેખમાં દર્શાવ્યા મુજબની વિગતે અવેજની રકમ મળેલ છે?	હા
૪	લેખમાં દર્શાવેલ વિગતો વાંચી, વંચાવીને, સમજી, વિચારીને તમે પોતે જાતે જ સહી/અંગુઠાનુ છાપ કરેલ છે તેમ કબુલ રાખો છો?	હા
૫	પાવર ઓફ એટર્ની આપનાર દસ્તાવેજની તારીખે હયાત છે?	----
૬	પાવર ઓફ એટર્નીના લેખમાં પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ/ઓએ સહી/અંગુઠાનુ નિશાન કરેલ છે?	----
૭	પાવર ઓફ એટર્નીનો લેખ દસ્તાવેજની તારીખે અમલમાં છે?	----
૮	ઓળખાણ આપવા સાડ તમને ઓળખતા હોય તેવી વ્યક્તિઓ સાથે લાવ્યા છો?	હા
ઓળખાણ આપનાર / સાક્ષી ને પુછવાના પ્રશ્નો :		
૧	દસ્તાવેજ લખી આપનાર વ્યક્તિ/ઓ કે જેઓએ કબુલાત આપી તેઓને તમે જાતે ઓળખો છો?	હા
૨	દસ્તાવેજમાં લખેલ નામ અને કબુલાત આપનાર વ્યક્તિ/ઓ એક જ છે?	હા
૩	કોઈ વ્યક્તિએ ખોટું નામ ધારણ કરીને કબુલાત આપી નથી એવી તમે ખાતરી આપો છો?	હા

લખી આપનાર / સંમતિ આપનાર/કુ.મુ.ની સહી

HAYOSHA BUILDTECH, નામની
ભાગીદારી પેઢી વતી વહીવટકર્તા ભાગીદાર

ઓળખાણ આપનાર (સાક્ષી) ની સહી :

સબ - રજીસ્ટ્રારની સહી :